




આર.એચ.દવે
નાણાં નિયંત્રક

ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ

જલસેવા ભવન, સે. ૧૦-એ ગાંધીનગર.

ફોન નં. ૨૩૨૫૧૦૪૮, ૮૮૭૮૪૪૧૧૦૨ (ફેક્સ: ૨૩૨૨૫૮૭૮)



एक कदम स्वच्छता की ओर

જાનં. એબી/સી.મે. ૧-૨/GST- Governmental Authority/૨૦૧૭-૧૮/F.N.-૮૮/૨૦૧૭/૬૩૩૬ તા.૨૭/૦૫/૨૦૧૭

વિષય :- ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા મેળવવામાં આવતી Pure Service અન્વયે ચુકવણી કરવામાં GST ચુકવવાપાત્ર ના હોવા બાબત

- વંચાણે લીધું:- (૧) કમીશ્નર ઓફ સ્ટેટ ટેક્સ કચેરીના અંગ્રેજી પત્ર ક્રમાંક: (ST/ACST/GST/ GWSSB REPLY/2017-18/B/141, તા.૧૮/૧૧/૧૭
- (૨) રાજ્ય સરકારના નાણાં વિભાગના નોટીફિકેશન નં. ૧૨/૨૦૧૭ State Tax (Rate) તા. ૩૦/૦૬/૨૦૧૭
- (૩) રાજ્ય સરકારના નાણાં વિભાગના નોટીફિકેશન નં. ૩૨/૨૦૧૭ State Tax (Rate) તા. ૧૩/૧૦/૨૦૧૭
- (૪) ભારત સરકારના નાણા મંત્રાલયના નોટીફિકેશન નં. ૧૨/૨૦૧૭ Central Tax (Rate), તા. ૨૮/૦૬/૨૦૧૭

પરિપત્ર

કમીશ્નર ઓફ સ્ટેટ ટેક્સ, ગુજરાત રાજ્યનો વંચાણે લીધેલ ક્રમાંક (૧) પ્રમાણેનો પત્ર આ સાથે Annexure- A મુજબ સામેલ છે. આ પત્રની વિગતે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ વંચાણે લીધેલ ક્રમાંક (૨) અને ક્રમાંક (૩) પ્રમાણેના નોટીફિકેશન મુજબ “Governmental Authority” ની વ્યાખ્યામાં આવતું હોઈ, તેને ક્રમાંક (૨) પ્રમાણેના નોટીફિકેશનમાં આપેલ ટેબલના ક્રમાંક (૩) મુજબ Exemption ના લાભ મળવાપાત્ર છે. આ Exemption ની વિગત નીચે મુજબ છે.

Sr No.	Chapter, Section Heading, Group or Service Code (Tariff)	Description of Services	Rate (per cent.)	Condition
(1)	(2)	(3)	(4)	(5)
3.	Chapter 99	Pure Services (excluding works contract service or other composite supply involving supply of any goods) provided to the Central Government, State Government or Union territory or local authority or a Governmental authority by way of any activity in relation to any function entrusted to a Panchayat under article 243G of the Constitution or in relation to any function entrusted to a Municipality under article 243W of the Constitution.	Nil	Nil

ઉપરોક્ત જોગવાઈ મુજબ બંધારણના અનુચ્છેદ 243-G મુજબ પંચાયતને સુપ્રત કરવામાં આવેલ હોય તેવી અથવા તો 243-W મુજબ નગરપાલિકાને સુપ્રત કરવામાં આવેલ હોય તેવી કોઈ પણ કામગીરી અન્વયે ગવર્નમેન્ટલ ઓથોરીટીને પૂરી પાડવામાં આવેલ Pure Service (વર્ક્સ કોન્ટ્રાક્ટ સર્વિસ અને માલનો સમાવેશ થતો હોય તેવા Composite Supplies સિવાયની સર્વિસ) પર GST (SGST) નો દર NIL (શૂન્ય) રહેશે. આ જ મુજબની જોગવાઈ વંચાણે લીધેલ ક્રમાંક (3) પ્રમાણેના રાજ્ય સરકારના અન્ય નોટીફિકેશનથી GST (SGST) માટે અને ક્રમાંક (૪) પ્રમાણેના ભારત સરકારના નોટીફિકેશનથી CGST માટે કરવામાં આવેલ છે. વંચાણે લીધેલ ક્રમાંક (૨), (૩) અને (૪) પ્રમાણેના નોટીફિકેશન્સની સંબંધિત જોગવાઈની નકલ “Annexure- B”, “Annexure- C” અને “Annexure- D” મુજબ સામેલ છે.

ઉપરોક્ત જોગવાઈઓની GWSSBની કામગીરી સંદર્ભે ચકાસણી કરતાં નીચેની બાબતો સ્પષ્ટ થાય છે.

- (૧) ગુ.પા.પુ અને ગ.વ્ય.બોર્ડ દ્વારા હાથ ધરવામાં આવતી પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા અંગેની કામગીરી એ બંધારણના અનુચ્છેદ 243-W સાથે સંલગ્ન અનુસૂચી-૧૨ (Twelfth Schedule) ના અનુ નં. (૫) અને (૬) મુજબની કામગીરી છે. બોર્ડની રચના આ કામગીરી કરવા માટે થયેલ છે.
- (૨) The Gujarat Water Supply & Sewerage Board Act. 1978ની Section-14 Duties & Function of the Board, બોર્ડની ફરજો અને કાર્યો દર્શાવે છે. આ Section-14 ની નકલ આ સાથે “Annexure- E” તરીકે સામેલ છે.
- (૩) બોર્ડ દ્વારા મેળવવામાં આવતી Services બોર્ડને સોંપવામાં આવેલ કામગીરી (Duties and Functions of Board) ને પૂર્ણ કરવા મેળવવામાં આવે છે. આથી, આવી સેવાઓ (Services) પૈકી Pure Service તરીકે પૂરી પાડવામાં આવતી સેવાઓ પર ઉક્ત બંને નોટીફિકેશન્સ મુજબ GST (SGST & CGST) નો દર શૂન્ય ગણવાનો રહે છે.
- (૪) બોર્ડ દ્વારા સામાન્ય રીતે મેળવવામાં આવતી સેવાઓ પૈકી Pure Services તરીકે ગણી શકાય તેવી સેવાઓની નમૂનારૂપ યાદી નીચે મુજબ છે.
 - I. PMC, CSC અને ટર્નકિ પ્રોજેક્ટના TPI તરીકેની સેવાઓ.
 - II. પ્રી-ઓડીટ, ઇન્ટરનલ ઓડીટ, સ્ટેચ્યુટરી ઓડીટ, પ્રોજેક્ટ અને બોર્ડના ટેક્સ ઓડીટ અંગેની સેવાઓ.
 - III. કાનૂની નિષ્ણાત/ ધારાશાસ્ત્રીની સેવાઓ
 - IV. સીક્યોરીટી અને મેનપાવર (આઉટસોર્સિંગ દ્વારા) અંગેની સેવાઓ.
 - V. સર્વેની કામગીરી માટે મેળવવામાં આવતી સેવાઓ.
 - VI. જલસેવા ભવન દ્વારા મેળવેલ આર્કિટેક્ટની સેવાઓ.

VII. ઇન્સ્પેક્શન સર્વીસીસ.

VIII. વોટર ટેસ્ટીંગ અંગેની સર્વિસ

આમ ઉપર મુજબની સેવાઓ બોર્ડ દ્વારા મેળવવામાં આવે ત્યારે ઉપરોક્ત નોટીફિકેશન્સમાં પ્રસિધ્ધ થયા મુજબ GSTનો લાગુ પડતો દર NIL (શૂન્ય) હોઇ આવી સર્વિસ અન્વયે GST સિવાયની રકમનું જ બીલ લેવું અને તે મુજબની રકમની જ ચૂકવણી કરવી. ઉપર જણાવેલ સેવાઓની યાદી ઉદાહરણ રૂપે દર્શાવેલ છે, જે આખરી નથી. પ્રત્યેક કચેરીની કામગીરી મુજબ આ યાદીમાં વધારો-ઘટાડો થઇ શકે છે. દરેક કચેરીએ પોતાના ધ્વારા મેળવવામાં આવતી સેવાઓનું આ પરીપત્ર મુજબ મૂલ્યાંકન કરી કાર્યવાહી કરવાની રહેશે. આ બાબતે કોઇ પણ જાતના માર્ગદર્શનની જરૂર જણાયેથી વડિ કચેરીનો સંપર્ક કરવાનો રહેશે. Pure Service તરીકે ગણી શકાય તેવી સેવાઓ પૂરી પાડનાર વ્યક્તિ/ એજન્સીને આ બાબતની જાણ કરી તેઓને આવી સેવાઓ અન્વયે GST સિવાયનું બીલ આપવા જણાવવું.

(૫) વંચાણે લીધેલ પત્રના અંતભાગમાં જણાયા મુજબ As, when and if mandated by the GST Council, GWSSB shall become Liable to deduct TDS as per Section- 51 of the SGST Act. આથી, TDS અંગેની જોગવાઈઓ જ્યારે અમલમાં આવશે ત્યારે તે મુજબ GWSSB દ્વારા GST નો TDS કાપવાની કાર્યવાહી કરવાની રહેશે. હાલ સરકારશ્રી દ્વારા તા. ૩૧/૦૩/૨૦૧૮ સુધી TDS of GST ની જોગવાઈઓ મોકૂફ રાખવામાં આવેલ છે.

આ પરિપત્રની સૂચનાઓ તાત્કાલિક અસરથી અમલમાં આવશે.

બિડાણ:- Annexure –A થી Annexure –E

(આર.એચ.દવે)

નાણાં નિયંત્રક

નકલ સવિનય રવાના પ્રતિ,

- અંગત સચિવશ્રી, માન. અધ્યક્ષશ્રીનું કાર્યાલય ગાંધીનગર તરફ જાણ સારું.
- અંગત સચિવશ્રી, માન. સભ્ય સચિવશ્રીનું કાર્યાલય ગાંધીનગર તરફ જાણ સારું.
- મેનેજીંગ ડિરેક્ટરશ્રી, જી.ડબલ્યુ.આઇ.એલ ગાંધીનગર તરફ જાણ સારું.
- મુખ્ય કારોબારી અધિકારીશ્રી, વાસ્મો ગાંધીનગર તરફ જાણ સારું.
- અધિક કમિશ્નરશ્રી, કમિશ્નર ઓફ સ્ટેટ ટેક્ષની કચેરી, આશ્રમ રોડ અમદાવાદ તરફ જાણ સારું.

નકલ રવાના પ્રતિ,

- મુખ્ય ઇજનેરશ્રી, વડી કચેરી તથા ઝોન-૧,૨,૩,૪ અને ૫ તરફ જાણ સારું.
- નિયામકશ્રી, ગુજરાત જલ સેવા તાલીમ સંસ્થા, ગાંધીનગર તરફ જાણ સારું.
- મુખ્ય ઇજનેરશ્રી મોની. અને પ્લાનીંગ/ટેક.સેલ/મટીરીયલ સેલ/યાંત્રીક વિભાગ ગાંધીનગર તરફ જાણ સારું.
- પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી, અર્બનસેલ, ગાંધીનગર તરફ જાણ સારું.
- મુખ્ય વહીવટી અધિકારી, બોર્ડ કચેરી ગાંધીનગર તરફ જાણ સારું.
- અધિક્ષક ઇજનેરશ્રી/કાર્યપાલક ઇજનેરશ્રી, (સર્વે) તરફ જાણ સારું.
- સીનીયર મેનેજર (ના/હિ), (સર્વે) તરફ જાણ સારું.
- સીસ્ટમ મેનેજરશ્રી, કોમ્પ્યુટર સેલ, બોર્ડ કચેરી ગાંધીનગર તરફ જાણ સારું.

- કાર્યપાલક ઇજનેરશ્રી, જાહેર આરોગ્ય યાંત્રિક સ્ટોર વિભાગ, ગાંધીનગર તરફ જાણ સારું.
- કાર્યપાલક ઇજનેરશ્રી, સ્ટોર વિભાગ (મહેકમ-૪), બોર્ડ કચેરી ગાંધીનગર તરફ જાણ સારું.
- નાયબ મેનેજર (ના/હિ), (સર્વે) તરફ જાણ સારું.
- નાયબ મેનેજર (વ) લીગલ શાખા/ મકમ શાખા ૧-૨/મકમ શાખા-૩/મકમ શાખા-૪/
તપાસ શાખા/ બોર્ડ સેલ, ગાંધીનગર તરફ જાણ સારું.
- આંતરિક ઓડીટરશ્રી/ પ્રી-ઓડીટરશ્રી, (તમામ) તરફ જાણ સારું.

Annexure - A

NO.CST/ACST/GST/GWS&SB REPLY/2017-18/B. ¹⁴¹/_{18/11/17}

Office of the Commissioner of state taxes
C-5, Rajya Kar Bhavan, Ashram Road,
Ahmedabad- 380009

Date: 18. 11. 2017

To

Member Secretary,

Gujarat Water Supply & Sewerage Board

Gandhinagar.

Subject : Status of Gujarat Water Supply & Sewerage Board as
a "Governmental Authority" under the GST Act.

Reference: Letter dated 18/9/2017 no: AB/SM -1-2/GST
ACT/20/718/F.N.89

Sir,

In reference to point C on page 8 of your above mentioned letter,

Following needs to be noted.

- 1) As per the amended entry 3 exemption notification no 12/2017- State Tax (Rate), 30/06/2017, vide notification no 32/2017 State Tax (Rate) 13/10/2017 pure services provided to Governmental Authority in relation to any function entrusted to a panchayat under article 243 (G) of the constitution or in relation to any function entrusted to a municipality under article 243 (W) of the constitution is exempt.

As per explanation 9zf) to the amended notification no.12 vide notification 32 "Governmental Authority" means an authority or a board or any other body, -

- (i) set up by an Act of Parliament or a State Legislature; or

12/11/17


20/11/17

*F.C.
CG (MTP)*

- (ii). established by any Government, with 90per cent. or more participation by way of equity or control, to carry out any function entrusted to a Municipality under article 243 W of the Constitution or to a Panchayat under article 243 G of the Constitution.

GWSSB is established by the Gujarat Water Supply & Sewerage Board Act 1978 of State Legislature, thus to the extent it is carrying out functions entrusted to a municipality under article 243 (W) and to a panchayat under article 243G (entry 5 & 6 of the twelfth schedule to the constitution) it shall be entitled to enjoy exemption as per entry 3 of exemption notification no 12/2017- State Tax (rate), 30/06/2017.

- 2) As, when and if mandated by the GST Council, GWSSB shall become liable to deduct TDS as per section 51 of the SGST Act.


Additional Commissioner of State taxes
(Establishment/Vigilance)
Gujarat State, Ahmedabad

Annexure - B

NOTIFICATION
FINANCE DEPARTMENT.
Sachivalaya, Gandhinagar.
Notification No. 12/2017-State Tax(Rate)
Dated the 30th June, 2017.

Gujarat
Goods
and
Services
Tax Act,
2017

No.(GHN-41)GST-2017/S.11(1)(7)-TH:- In exercise of the powers conferred by sub-section (1) of section 11 of the Gujarat Goods and Services Tax Act, 2017 (Guj.25 of 2017), the Government of Gujarat, on being satisfied that it is necessary in the public interest so to do, on the recommendations of the Council, hereby exempts the intra-State supply of services of description as specified in column (3) of the Table below from so much of the State tax leviable thereon under sub-section (1) of section 9 of the said Act, as is in excess of the said tax calculated at the rate as specified in the corresponding entry in column (4) of the said Table, unless specified otherwise, subject to the relevant conditions as specified in the corresponding entry in column (5) of the said Table, namely:-

Table

Sr. No.	Chapter, Section, Heading, Group or Service Code (Tariff)	Description of Services	Rate (per cent.)	Condition
(1)	(2)	(3)	(4)	(5)
1	Chapter 99	Services by an entity registered under section 12AA of the Income-tax Act, 1961 (43 of 1961) by way of charitable activities.	Nil	Nil
2	Chapter 99	Services by way of transfer of a going concern, as a whole or an independent part thereof.	Nil	Nil
3	Chapter 99	Pure services (excluding works contract service or other composite supplies involving supply of any goods) provided to the Central Government, State Government or Union territory or local authority or a Governmental authority by way of any activity in relation to any function entrusted to a Panchayat under article 243G of the Constitution or in relation to any function entrusted to a Municipality under article 243W of the Constitution.	Nil	Nil
4	Chapter 99	Services by Central Government, State	Nil	Nil

Annexure - C

NOTIFICATION
FINANCE DEPARTMENT.
Sachivalaya, Gandhinagar.
Notification No. 32/2017-State Tax(Rate)
Dated the 13th October, 2017.

Gujarat
Goods
and
Services
Tax Act,
2017.

No.(GHN-109)GST-2017/S.11(1)(18)-TH:- In exercise of the powers conferred by sub-section (1) of section 11 of the Gujarat Goods and Services Tax Act, 2017 (Guj.25 of 2017), the Government of Gujarat, on being satisfied that it is necessary in the public interest so to do, on the recommendations of the Council, , hereby makes the following further amendments in the Government Notification, Finance Department No.(GHN-41)GST-2017/S.11(1)(7)-TH, Dated the 30th June, 2017, Notification No.12/2017- State Tax (Rate), namely:-

(i) in the Table, -

(a) in serial number 5, in column (3), for the words “governmental authority” the words “Central Government, State Government, Union territory, local authority or Governmental Authority” shall be substituted;

(b) after serial number 9B and the entries relating thereto, the following serial number and entries shall be inserted, namely: -

(1)	(2)	(3)	(4)	(5)
“9C	Chapter 99	Supply of service by a Government Entity to Central Government, State Government, Union territory, Local authority or any person specified by Central Government, State Government, Union territory or local authority against consideration received from Central Government, State Government, Union territory or Local authority, in the form of grants.	Nil	Nil” ;

(c) after serial number 21 and the entries relating thereto, the following serial number and entries shall be inserted namely: -

(1)	(2)	(3)	(4)	(5)
"21A	Heading 9965 or Heading 9967	Services provided by a goods transport agency to an unregistered person, including an unregistered casual taxable person, other than the following recipients, namely: - (a) any factory registered under or governed by the Factories Act, 1948(63 of 1948); or (b) any Society registered under the Societies Registration Act, 1860 (21 of 1860) or under any other law for the time being in force in any part of India; or (c) any Co-operative Society established by or under any law for the time being in force; or (d) any body corporate established, by or under any law for the time being in force; or (e) any partnership firm whether registered or not under any law including association of persons; (f) any casual taxable person registered under the Central Goods and Services Tax Act or the Integrated Goods and Services Tax Act or the State Goods and Services Tax Act or the Union Territory Goods and Services Tax Act.	Nil	Nil" ;

(d) after serial number 23 and the entries relating thereto, the following serial number and entries shall be inserted namely: -

(1)	(2)	(3)	(4)	(5)
"23A	Heading 9967	Service by way of access to a road or a bridge on payment of annuity.	Nil	Nil" ;

(e) in serial number 41, for the entry in column (3), the following entry shall be substituted, namely: -

"Upfront amount (called as premium, salami, cost, price, development charges or by any other name) payable in respect of

service by way of granting of long term lease of thirty years, or more of industrial plots or plots for development of infrastructure for financial business, provided by the State Government Industrial Development Corporations or Undertakings or by any other entity having 50 per cent. or more ownership of Central Government, State Government, Union territory to the industrial units or the developers in any industrial or financial business area.”;

- (ii) in paragraph 2, for clause (zf), the following clauses shall be substituted, namely: -

“(zf) “Governmental Authority” means an authority or a board or any other body, -

- (i) set up by an Act of Parliament or a State Legislature; or
- (ii) established by any Government, with 90 per cent. or more participation by way of equity or control, to carry out any function entrusted to a Municipality under article 243 W of the Constitution or to a Panchayat under article 243 G of the Constitution.

(zfa) “Government Entity” means an authority or a board or any other body including a society, trust, corporation,
(i) set up by an Act of Parliament or State Legislature; or
(ii) established by any Government, with 90 per cent. or more participation by way of equity or control, to carry out a function entrusted by the Central Government, State Government, Union Territory or a local authority.”.

By order and in the name of the Governor of Gujarat,

C J Mecwan
Joint Secretary to Government.

Annexure- D

[TO BE PUBLISHED IN THE GAZZETE OF INDIA, EXTRAORDINARY, PART II, SECTION 3, SUB-SECTION (i)]

Government of India
Ministry of Finance
(Department of Revenue)

Notification No. 12/2017- Central Tax (Rate)

New Delhi, the 28th June, 2017

G.S.R.....(E).- In exercise of the powers conferred by sub-section (1) of section 11 of the Central Goods and Services Tax Act, 2017 (12 of 2017), the Central Government, on being satisfied that it is necessary in the public interest so to do, on the recommendations of the Council, hereby exempts the intra-State supply of services of description as specified in column (3) of the Table below from so much of the central tax leviable thereon under sub-section (1) of section 9 of the said Act, as is in excess of the said tax calculated at the rate as specified in the corresponding entry in column (4) of the said Table, unless specified otherwise, subject to the relevant conditions as specified in the corresponding entry in column (5) of the said Table, namely:-

Table

Sl. No.	Chapter, Section, Heading, Group or Service Code (Tariff)	Description of Services	Rate (per cent.)	Condition
(1)	(2)	(3)	(4)	(5)
1	Chapter 99	Services by an entity registered under section 12AA of the Income-tax Act, 1961 (43 of 1961) by way of charitable activities.	Nil	Nil
2	Chapter 99	Services by way of transfer of a going concern, as a whole or an independent part thereof.	Nil	Nil
3	Chapter 99	Pure services (excluding works contract service or other composite supplies involving supply of any goods) provided to the Central Government, State Government or Union territory or local authority or a Governmental authority by way of any activity in relation to any function entrusted to a Panchayat under article 243G of the Constitution or in	Nil	Nil

Annexure: E

❖ Section-14 Duties & Function of the Board Details:

- a. To prepare, execute, promote and finance the schemes for supply of water and for sewerage and sewerage disposal.
- b. To render all necessary services in regard to water supply and sewerage to the state government and local bodies and on request to private institutions or individual also.
- c. To prepare draft state plans for water supply, sewerage and drainage on the directions of the state government.
- d. To review and advise on the tariff, taxes, fees, and charges of water supply and sewerage systems, in the areas comprised within the sphere of operation of water supply and sewerage services of the Board and in the areas of the local bodies which have entered into an agreement with the Board;
- e. To assess the requirement of the materials and arrange for their procurement and utilization;
- f. To establish state standards for water supply and sewerage services
- g. To review annually the technical, financial, economic and other aspects of water supply and sewerage system of every scheme of the board of the local bodies which have entered into an agreement with the board.
- h. To establish and maintain a facility to review and appraise the technical, financial, economic and other pertinent aspects of every water supply and sewerage scheme in the state.
- i. To operate, run and maintain any water works and sewerage system, if and when directed by the state government, on such terms and conditions and for such period as may be specified by the state government.
- j. To assess requirement for man-power and training in relation to water supply and sewerage services in the state.
- k. To carry out applied research for efficient discharge of the Duties and Functions of the board.
- l. To perform such of the duties and functions, which are being performed by the Gujarat Public Health Engineering Service, as may be specified, from time to time, by the State Government.
- m. To perform and discharge such other duties and functions as are allotted to the board under the provisions of this Act or as may be entrusted to it by the State Government.



આર.એચ.દવે
નાણાં નિયંત્રક

ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ

(ગુજરાત સરકારનું સાહસ)

“જલસેવા ભવન” સેક્ટર નં.૧૦/એ, એરફોર્સ કચેરીની સામે, ગાંધીનગર-૩૮૨ ૦૧૦



જલ સેવા ભવન નં ૧૦

Ph. No. 079-23251048 PABX : 23222547
FAX No. 079-232 25979

Email :- fcgwssb@gmail.com, website :gwssb.gujarat.gov.in

નં. એબી/સીમે-૧-૨/૨૦૧૭-૧૮/ફા.નં.૯૦/૨૩૮

તા. ૧૮/૬/૧૭

પ્રતિ,

- (૧) મુખ્ય ઇજનેરશ્રી,
ઝોન-૧ વડોદરા/ઝોન-૨ અમદાવાદ
ઝોન-૩ રાજકોટ/ઝોન-૪ કચ્છ-ભુજ/ઝોન-૫ જુનાગઢ
- (૨) પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી, અર્બનસેલ, વડી કચેરી, ગાંધીનગર.
- (૩) નિયામકશ્રી, જીજેટીઆઇ, સે.૧૫, ગાંધીનગર.
- (૪) કાર્યપાલક ઇજનેરશ્રી, જા.આ.યાં.સ્ટોર વિભાગ, ગાંધીનગર.

વિષય :- સરકારશ્રીના માર્ગ અને મકાન વિભાગના ઠરાવ અન્વયે ટેન્ડર ફોર્મ બી-૧, કલોઝ-૪૮ અને ફોર્મ-બી-૨, કલોઝ-૪૭ માં GST અન્વયે જરૂરી સુધારો બહાર પાડવા બાબત.

- સંદર્ભ :-** ૧) માર્ગ અને મકાન વિભાગ ગાંધીનગરના પરીપત્ર નં. ટીએનસી-૧૦-૨૦૧૭-૦૧-સી, તા.૨૯.૮.૨૦૧૭
૨) માર્ગ અને મકાન વિભાગ ગાંધીનગરના પરીપત્ર નં. એસએઆર-૧૦-૨૦૧૭-૫૦-સી, તા.૨૯.૮.૨૦૧૭

ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે, તા. ૦૧/૦૭/૨૦૧૭ થી અમલી બનેલ Goods & Services Tax (GST) અન્વયે સરકારશ્રીના માર્ગ અને મકાન વિભાગ દ્વારા સંદર્ભ (૧) અને (૨) પ્રમાણેના પરિપત્ર કરવામાં આવેલ છે. સંદર્ભ (૧) ના પરિપત્ર દ્વારા ટેન્ડર માટેનાં ફોર્મ બી-૧ કલોઝ-૪૮ અને ફોર્મ બી-૨ કલોઝ ૪૭ની જોગવાઈઓમાં સુધારો કરવામાં આવેલ છે જ્યારે સંદર્ભ (૨) ના પરિપત્રથી ફોર્મ બી-૧ ની કલોઝ ૭૮ અને ફોર્મ બી-૨ ની કલોઝ ૭૭ રદ કરવામાં આવેલ છે. પાણી પુરવઠા બોર્ડના ટેન્ડરોમાં પણ આ પરીપત્ર મુજબ કાર્યવાહિ કરવા જણાવવામાં આવે છે. સંદર્ભ (૧) અને (૨) પ્રમાણેનાં પરિપત્રની નકલ આ સાથે સામેલ છે.

(નોંધ પરની માન. અધ્યક્ષશ્રીની મુજબ)

બિડાણ : ઉપર મુજબ

(આર.એચ.દવે)
નાણાં નિયંત્રક

નકલ સવિનય રવાના

- માન. અધ્યક્ષશ્રીના કાર્યકારી સચિવશ્રી, વડી કચેરી, ગાંધીનગર.
- સભ્ય સચિવશ્રીના અંગત મદદનીશશ્રી, વડી કચેરી, ગાંધીનગર.

નકલ રવાના

- મુખ્ય ઇજનેરશ્રી ટેકનીકલ/(મોની/પ્લાં)/મટીરીયલ/ચાંત્રિક/ વડી કચેરી, ગાંધીનગર.
- મુખ્ય વહીવટી અધિકારીશ્રી, વડી કચેરી, ગાંધીનગર.
- અધિક્ષક ઇજનેરશ્રી, ટેકનીકલ/મોની-પ્લાં/મટીરીયલ/વડી કચેરી, ગાંધીનગર.
- અધિક્ષક ઇજનેરશ્રી, તકેદારી એકમ, વડી કચેરી, ગાંધીનગર.
- સીનીયર મેનેજરશ્રી (ના/હિ) ૧-૨/૩-૪-૫ વડી કચેરી, ગાંધીનગર.

ગુજરાત સરકાર
માર્ગ અને મકાન વિભાગ
બ્લોક નં. ૧૪/૨, સરદાર ભવન,
સચિવાલય, ગાંધીનગર
ક્રમાંક: TNC-10-2017-01-C
તા. ૨૯/૦૮/૨૦૧૭


પરિપત્ર

હાલમાં રાષ્ટ્રીય કક્ષાએ જી.એસ.ટી. બીલને મંજૂરી મળેલ છે. ટેન્ડર પ્રક્રિયાથી થતા કામો ઉપર વિવિધ પ્રકારના વેરા (ટેક્સ) લાગુ પડતા હોય છે. જી.એસ.ટી. બીલ મુજબ ટેક્સ ભરપાઈ કરવાની અમલવારી થવાથી ટેન્ડર પ્રક્રિયાના વિવિધ નાણાંકીય પાસાઓના ઢાંચા ઉપર તેમજ તેને આનુષંગિક પ્રક્રિયા ઉપર થતી અસરને ધ્યાનમાં લઈ ટેન્ડર માટેના ફોર્મ બી-૧ કલોઝ-૪૮ અને ફોર્મ બી-૨ કલોઝ-૪૭ માં દર્શાવેલ ટેક્સ બાબતે કેન્દ્ર સરકાર તરફથી મંજૂર થયેલ જી.એસ.ટી. બીલના કારણે નીચે મુજબના ફેરફાર કરવાના થાય છે.

EXISTING CLAUSE	AMENDMENT
Form B-1 Clause 48 Form B-2 Clause 47 : The rates to be quoted by the Contractor must be inclusive of sales tax. No extra payment on this account will be made to the contractor.	Form B-1 Clause 48 Form B-2 Clause 47: The rates to be quoted by the Contractor must be inclusive of all taxes prevailing on due date of bid submission. However any subsequent changes in the tax structure by Government after due date of bid submission will be compensated (\pm) on availability or submission of actual documentation. Contractor has to intimate Engineer in charge regarding changes occurred in the tax structure after bid submission. If contractor fails to provide such information and if any financial obligation may arise due to change in tax structure, same will be recovered from the contractor. The contractor shall apply fair means of stock maintenance and shall adopt accounting standards as may be prescribed under GST. For arriving at the difference in procurement prices due to introduction of GST, it will be open for the Government to ask for original invoices, LR, weigh bridge slips, payment details and such other documents as may be required for the purpose. If there is reduction in overall tax burden then proportional benefit of that shall be passed on to the Government.

આ પરિપત્ર અત્રેની વિભાગની ફાઇલ નં. ટીએનસી-૧૦-૨૦૧૭-૦૧-સી ઉપર નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ, નાણાં વિભાગ અને કાયદા વિભાગની સંમતિથી બહાર પાડવામાં આવે છે.

ઉપરોક્ત તમામ સુચનાનો અમલ ચુસ્તપણે તાત્કાલિક અસરથી કરવાનો રહેશે.


(એન.જી.પરમાર)

ખાસ ફરજ પરના અધિકારી (વિ.ચો.)
માર્ગ અને મકાન વિભાગ
ગાંધીનગર

પ્રતિ,

૧. અંગત સચિવશ્રી, સચિવશ્રીનું કાર્યાલય, માર્ગ અને મકાન વિભાગ, સચિવાલય, ગાંધીનગર
૨. અંગત સચિવશ્રી, સચિવશ્રીનું કાર્યાલય, નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ, સચિવાલય, ગાંધીનગર
૩. અંગત સચિવશ્રી, અગ્રસચિવશ્રીનું કાર્યાલય, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, સચિવાલય, ગાંધીનગર
૪. અંગત સચિવશ્રી, અધિક મુખ્ય સચિવશ્રીનું કાર્યાલય, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, સચિવાલય, ગાંધીનગર
૫. અંગત સચિવશ્રી, અગ્રસચિવશ્રીનું કાર્યાલય, પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, સચિવાલય, ગાંધીનગર
૬. એકાઉન્ટન્ટ જનરલશ્રી, રાજકોટ/અમદાવાદ
૭. સર્વે મુખ્ય ઇજનેરશ્રીઓ, માર્ગ અને મકાન વિભાગ, સચિવાલય, ગાંધીનગર
૮. સર્વે મુખ્ય ઇજનેરશ્રીઓ, નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ, સચિવાલય, ગાંધીનગર
૯. મેનેજીંગ ડીરેક્ટરશ્રી, ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ, નિર્માણભવન, ગાંધીનગર
૧૦. મુખ્ય ઇજનેરશ્રી અને ડાયરેક્ટરશ્રી, સ્ટાફ ટ્રેનીંગ કોલેજ, ગાંધીનગર
૧૧. ડાયરેક્ટરશ્રી, ગુજરાત એન્જીનીયરીંગ રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ (ગેરી), વડોદરા
૧૨. ઉપસચિવશ્રી, ગુજરાત તકેદારી આયોગ, તકેદારી ભવન, ગાંધીનગર
૧૩. નાણાં સલાહકારશ્રી, માર્ગ અને મકાન વિભાગ, સચિવાલય, ગાંધીનગર
૧૪. સર્વે અધિક્ષક ઇજનેરશ્રીઓ, માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય, પંચાયત, ને.હા., પાટનગર યોજના વર્તુળ, વિદ્યુત વર્તુળ સહીત)
૧૫. સર્વે કાર્યપાલક ઇજનેરશ્રીઓ (ઉક્ત વર્તુળ હેઠળના)
૧૬. સર્વે તાંત્રિક અધિકારીશ્રીઓ, માર્ગ અને મકાન વિભાગ, સચિવાલય, ગાંધીનગર
૧૭. સર્વે તાંત્રિક શાખાઓ, માર્ગ અને મકાન વિભાગ, સચિવાલય, ગાંધીનગર
૧૮. પ્રમુખશ્રી, ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસીએશન, ગજજરા હોલ, લો ગાર્ડન, લો કોલેજ રોડ, અમદાવાદ
૧૯. શાખા સીલેક્ટ ક્ષણ-૨૦૧૭

૫૩

વેટને સ્થાને જી.એસ.ટી.ના અમલવારી તથા
પર્સન્ટેજ રેટ (બી-૧) ટેન્ડર ફોર્મના માપદંડોમાં
સુધારો થતા બી-૧ અને બી-૨ ફોર્મના કલોઝમાં
સુધારા બાબત

ગુજરાત સરકાર
માર્ગ અને મકાન વિભાગ
બ્લોક નં.૧૪/૨, સરદાર ભવન,
સચિવાલય, ગાંધીનગર
ક્રમાંક: SSR-10-2017-50-C
તા.૨૯/૦૮/૨૦૧૭

પરિપત્ર

હાલમાં રાષ્ટ્રીય કક્ષાએ જી.એસ.ટી. બીલને મંજૂરી મળેલ છે અને તેની અમલવારી તા.૦૧/૦૭/૨૦૧૭થી કરવામાં આવેલ હોઇ ટેન્ડર પ્રક્રિયાના વિવિધ નાણાંકીય પાસાઓના ઢાંચા ઉપર તેમજ તેને આનુષંગિક પ્રક્રિયા ઉપર થતી અસરને ધ્યાનમાં લઇ ટેન્ડર માટેના ફોર્મ બી-૧ અને ફોર્મ બી-૨ ના કલોઝમાં જરૂરી સુધારા કરવા જરૂરી છે.


વધુમાં પરિપત્ર ક્રમાંક:TNC-1088-D-347-(7)-C તા.૧૧/૦૭/૨૦૧૭થી રસ્તાના કામો માટે રૂ.૧૨ કરોડ તથા મકાન અને પુલોના કામો માટે રૂ.૧૦ કરોડ સુધીના કામો માટેના ટેન્ડરો પર્સન્ટેજ રેટ (બી-૧) ફોર્મમાં માગવા બાબતનો જરૂરી સુધારો કરવામાં આવેલ હોવાથી ટેન્ડર માટેના ફોર્મ બી-૧ ના કલોઝમાં જરૂરી સુધારા કરવા જરૂરી છે.

ઉપરોક્ત બંને બાબતોને ધ્યાને લેતા ટેન્ડર માટેના ફોર્મ બી-૧ અને બી-૨ના કલોઝમાં નીચે મુજબના ફેરફાર કરવાના થાય છે.

EXISTING CLAUSE	AMENDMENT
<u>ફોર્મ બી-૧ કલોઝ-૭૮</u> <u>ફોર્મ બી-૨ કલોઝ-૭૭</u> ચૂકવવાના બીલમાંથી જે તે સમયે લાગુ પડતો વેટ, ગુજરાત વેટ અધિનિયમ-૨૦૦૩ મુજબની જોગવાઈ મુજબ ચૂકવણાના સ્થાનેથી કાપવાપાત્ર હશે તો તે કાપવામાં આવશે. હાલની જોગવાઈ મુજબ એક કરોડથી વધારે કિંમતના કરારોના કામોમાં એડવાન્સ વેટ (TDS) કાપવાની જોગવાઈ અમલમાં છે. આ બાબત એટ સોર્સ કાપવાને લગતી હોઇ આ અંગેના કાયદામાં વખતોવખત જે ફેરફારો થશે તે મુજબ ટેક્સ કપાત કરવામાં આવશે. ઇજારદારે ભાવો ટેક્સ સહિત ભરવાના હોઇ આ ટેક્સ કપાત મજરે મળવાપાત્ર નથી. (નાણાં વિભાગના તા.૧/૪/૨૦૦૮ના જાહેર નામા ક્રમાંક: (જી.એચ.એન.-૧૪) વેટ-૨૦૦૮-એસ-૫૯-બી (૩) (૧) થ	<u>ફોર્મ બી-૧ કલોઝ-૭૮</u> <u>ફોર્મ બી-૨ કલોઝ-૭૭</u> ૨૯

EXISTING CLAUSE	AMENDMENT
<p><u>ફોર્મ બી-૧ કલોઝ-૨૪</u></p> <p>Deleted</p>	<p><u>ફોર્મ બી-૧ કલોઝ-૨૪</u></p> <p>રૂપિયા એક કરોડથી વધુ રકમના વાઇડનીંગ અને સ્ટ્રેન્થીંગના કામોમાં દરેક સ્તરનું કોમ્પેક્શન વ્યવસ્થિત રીતે થાય તે માટે નીચેની કાર્યવાહી અનુસરવાની રહેશે.</p> <p>૨૪.૧ રસ્તાની કરવાની પહોળાઇમાં ધારાધોરણ મુજબ કોમ્પેક્શન થાય તે માટે બેબી રોલર ફરજિયાત રીતે લાવી કોમ્પેક્શન કરવાનું રહેશે.</p> <p>૨૪.૨ આવા કામોમાં દરેક સ્તરનું કોમ્પેક્શન ધારાધોરણ મુજબ થયું છે, તેની દરેક લેયરે ફરજિયાતપણે ડેન્સિટીમીટરથી ગ્રીડ પ્રમાણે થયાની ચકાસણી ઇજારદારે કરી તેનું રજીસ્ટર નિભાવવાનું રહેશે. આવી ચકાસણી સંબંધિત નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી અને મદદનીશ/અધિક મદદનીશ ઇજનેરશ્રીએ પણ કરવાની રહેશે. ઇજારદારે કરેલ કામની ડેન્સિટી પૂરેપૂરી મળ્યા બાદ જ કિલયરન્સ અપાય અને ત્યારબાદ જ બીજા લેયરની કામગીરી હાથ ધરાય તે જોવાનું રહેશે. ઇજારદારશ્રીને તેમણે કરેલ કામગીરી અંગે જ્યારે પણ બીલની ચૂકવણી કરવાની થાય ત્યારે ઉપરોક્ત સૂચવેલ પદ્ધતિ પ્રમાણે તે કામ કરવામાં આવેલ છે કે કેમ? તેની ખરાઇ સંબંધિત અધિક્ષક ઇજનેરશ્રી પાસે કરાવ્યા બાદ જ બીલનું ચૂકવણું કરવામાં આવશે.</p> <p>(મા.મ.વિ. પરિપત્ર નં. એસ.એસ.આર.-૧૦-૨૦૦૮-૧૮-સી, તા.૧૩/૧૦/૨૦૦૮)</p>

ઉપરોક્ત તમામ સુધારાનો અમલ ચુસ્તપણે તાત્કાલિક અસરથી કરવાનો રહેશે.


 (એન.જી. પરમાર)
 ખાસ ફરજ પરના અધિકારી (વિ.ચો.)
 માર્ગ અને મકાન વિભાગ
 ગાંધીનગર

પ્રતિ,

૧. અંગત સચિવશ્રી, સચિવશ્રીનું કાર્યાલય, માર્ગ અને મકાન વિભાગ, સચિવાલય, ગાંધીનગર
૨. અંગત સચિવશ્રી, સચિવશ્રીનું કાર્યાલય, નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ, સચિવાલય, ગાંધીનગર
૩. અંગત સચિવશ્રી, અગ્રસચિવશ્રીનું કાર્યાલય, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, સચિવાલય, ગાંધીનગર
૪. અંગત સચિવશ્રી, અધિક મુખ્ય સચિવશ્રીનું કાર્યાલય, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, સચિવાલય, ગાંધીનગર
૫. અંગત સચિવશ્રી, અગ્રસચિવશ્રીનું કાર્યાલય, પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, સચિવાલય, ગાંધીનગર
૬. એકાઉન્ટન્ટ જનરલશ્રી, રાજકોટ/અમદાવાદ
૭. સર્વે મુખ્ય ઇજનેરશ્રીઓ, માર્ગ અને મકાન વિભાગ, સચિવાલય, ગાંધીનગર
૮. સર્વે મુખ્ય ઇજનેરશ્રીઓ, નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ, સચિવાલય, ગાંધીનગર
૯. મેનેજીંગ ડીરેક્ટરશ્રી, ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ, નિર્માણભવન, ગાંધીનગર
૧૦. મુખ્ય ઇજનેરશ્રી અને ડાયરેક્ટરશ્રી, સ્ટાફ ટ્રેનીંગ કોલેજ, ગાંધીનગર
૧૧. ડાયરેક્ટરશ્રી, ગુજરાત એન્જીનીયરીંગ રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ (ગેરી), વડોદરા
૧૨. ઉપસચિવશ્રી, ગુજરાત તકેદારી આયોગ, તકેદારી ભવન, ગાંધીનગર
૧૩. નાણાં સલાહકારશ્રી, માર્ગ અને મકાન વિભાગ, સચિવાલય, ગાંધીનગર
૧૪. સર્વે અધિક્ષક ઇજનેરશ્રીઓ, માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય, પંચાયત, ને.હા., પાટનગર યોજના વર્તુળ, વિદ્યુત વર્તુળ સહીત)
૧૫. સર્વે કાર્યપાલક ઇજનેરશ્રીઓ (ઉક્ત વર્તુળ હેઠળના)
૧૬. સર્વે તાંત્રિક અધિકારીશ્રીઓ, માર્ગ અને મકાન વિભાગ, સચિવાલય, ગાંધીનગર
૧૭. સર્વે તાંત્રિક શાખાઓ, માર્ગ અને મકાન વિભાગ, સચિવાલય, ગાંધીનગર
૧૮. પ્રમુખશ્રી, ગુજરાત કોન્ક્રીટર્સ એસોસિએશન, ગજજરા હોલ, લો ગાર્ડન, લો કોલેજ રોડ, અમદાવાદ
૧૯. શાખા સીલેક્ટ ફાઇલ-૨૦૧૭



ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ

તકેદારી એકમ, જલસેવા ભવન ચેરફ્રીસ સ્ટેશન સામે,

સેક્ટર-૧૦ /એ, ગાંધીનગર ✉ : ૦૭૯-૨૩૨૫૧૩૬૦ Fax: ૨૩૨-૨૫૯૭૯

Email: vigilancecell@gmail.com

જા.નં. તકેદારી એકમ/ઇન્સ્પેક્શન નોંધ/૧૮૮

તારીખ:- ૧૯/૦૩/૨૦૧૨

પરિપત્ર

ઇજારદાર મારફતે થતી કામગીરીના ટેન્ડરમાં જે જે બાબતો માટે ઇન્સ્યોરન્સ લેવાની જોગવાઈ કરાયેલ હોય તેના માટે નીચે જણાવ્યા મુજબની જોગવાઈઓ સ્પષ્ટ રૂપે કરારખતમાં રાખવાની સૂચના ગુજરાત તકેદારી આયોગ દ્વારા આપવામાં આવેલ છે.

- (૧) ઇજારદાર ધ્વારા ચોક્કસ સમયમાં ઇન્સ્યોરન્સ લઈને આધાર /પુરાવા સહિત જાણ ન કરાય તો આવા ઇન્સ્યોરન્સ નહીં લેવાના કારણે જે કોઈ જવાબદારી ઉભી થશે તેની સંપૂર્ણ જવાબદારી ઇજારદારની રહેશે અને તે પટે જે કોઈ રકમની વસુલાત કરવાની જરૂર પડે તો ઇજારદારની વહેણી નીકળતી કોઈ પણ રકમમાંથી બોર્ડ વસુલ કરી શકશે.
- (૨) ઇન્સ્યોરન્સ નહીં લેવા બદલ ઇજારદાર પાસેથી બોર્ડ ઇંડનીય રકમ વસુલ કરી શકશે. ઇંડનીય રકમ વસુલ કરવા છતાં ઇજારદારની ઇન્સ્યોરન્સ લેવાની જવાબદારી ચાલુ રહેશે, તથા આ જવાબદારીમાંથી તેઓ મુક્ત થતા નથી.

(મહેશ સિંહ)

સભ્ય સચિવ

સંમતિ/સચિવ રવાના પ્રતિ,

એક્શન અધિકારીશ્રી, ગુજરાત તકેદારી આયોગ, ગાંધીનગરને તેમના પત્રાંક પીવીઆઈ/૧૯/૨૦૦૮/૧૭૯૫૮૩/ગ, તા.૯/૬/૨૦૧૧ અન્વયે બોર્ડ કરેલ કાર્યવાહી

અર્થે જાણ સારુ.

સર્વે મુખ્ય ઇજનેરશ્રી/ સર્વે અધિક્ષક ઇજનેરશ્રી/ સર્વે કાર્યપાલક ઇજનેરશ્રી

માસ્ટર ફાઇલ.

Disseminated by V.B.Nagrich-2 પરિપત્ર.doc

ABTC

ટેન્ડરમાં ભરેલ અસામાન્ય ઉંચા ભાવોના સંદર્ભે કામ પર પડતા ખર્ચ પર નિયંત્રણ રાખવા તથા કામની નાણાંકીય પ્રગતિ ભૌતિક પ્રગતિ સાથે સુમેળમાં રહે તે માટે જરૂરી જોગવાઈ કરવા બાબત.

ગુજરાત સરકાર
માર્ગ અને મકાન વિભાગ
પરિપત્ર કં. પરચ/૧૦૨૦૦૮/(૬૧)/સ
તા. ૨૭-૧૧-૨૦૦૮.

પરિપત્ર :

ટેન્ડરમાં અસામાન્ય ઉંચા કે નીચા ભાવો ડિજિટાઇઝેશન દ્વારા ઘણી વાર ભરાતા હોવાનું સરકારશ્રીના ધ્યાન પર આવેલ છે. આવા કિસ્સાઓમાં કામની નાણાંકીય પ્રગતિ અને ભૌતિક પ્રગતિનો સુમેળ ન રહેવાની સંભાવના રહેલી છે. આથી કામની ભૌતિક પ્રગતિ પ્રમાણે નાણાંકીય પ્રગતિ રહે કે જેથી સરકારશ્રી પર સમય વહેલાં અયોગ્ય નાણાંકીય બોજ ન પડે તે માટે નીચે મુજબની જોગવાઈ ટેન્ડરમાં કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે. આ જોગવાઈ તમામ કામોના આ પરિપત્રની તારીખ પછી મંજૂર થતાં ડી.ટી.પી. માં અચૂક પણ કરવાની રહેશે.

જોગવાઈ :

જે કોઈ આઈટમનો ભરેલ ભાવ તે આઈટમના ટેન્ડરમાં મૂકેલ અંદાજ ભાવ કરતાં ટેન્ડરમાં મૂકેલ અંદાજ રકમથી સમગ્ર ટેન્ડર જેટલા ટકા ઉંચું કે નીચું મંજૂર થયું હોય તે ટકાવારીથી ૧૦% થી વધુ ઉંચું રહેતો હોય તેવી આઈટમનું ચૂકવણું રેન્ડીંગ બીલ વખતે જે તે આઈટમના અંદાજ ભાવ +/- મંજૂર ટેન્ડરની ટકાવારી + તે આઈટમના અંદાજ ભાવની ૫% ની મર્યાદામાં કરવામાં આવશે. આ રીતે વીથહેલ રાખેલ કામ સંતોષકારક રીતે પૂર્ણ થયે ફાઇનલ બિલ મંજૂર કરતી વખતે વ્યાજભારણ વગર છૂટી કરવામાં આવશે.

ઉક્ત જોગવાઈની સ્પષ્ટ સમજણ માટે આ સાથે આપેલ ઉદાહરણ ધ્યાને લેવું.

(૨)

૧.	ટેન્ડરમાં મૂકેલ અંદાજી રકમ	રૂ. ૧૦૦/-
૨.	મંજૂર થયેલ ટેન્ડરની રકમ	રૂ. ૧૧૦/-
૩.	ટેન્ડરમાં મૂકેલ અંદાજી રકમ સામે ખરેખર મંજૂર થયેલ ટેન્ડરની ટકાવારી	રૂ. ૧૦%
૪.	ટેન્ડરની એક આઈટમનો ટેન્ડરમાં મૂકેલ અંદાજી ભાવ	રૂ. ૧૦/-
૫.	તે આઈટમનો ભરેલ ભાવ	રૂ. ૧૪/-
૬.	તે આઈટમમાં ભરેલ ઊંચા ભાવની ટકાવારી	૪૦%
૭.	તે આઈટમ માટે રનીંગ બીલ વખતે ચૂકવવાપાત્ર ભાવ	રૂ. ૧૦ + કોલમ-૩ પ્રમાણે ૧૦% ઊંચા + અંદાજી ભાવના ૫% = રૂ. ૧૧.૫૦
૮.	ફાઈનલ બિલ વખતે વ્યાજ ભારણ વગર ચૂકવવાપાત્ર થતો વીશ હેલ્ડ રાખેલ ભાવ.	રૂ. ૧૪.૦૦ - રૂ. ૧૧.૫૦ રૂ. ૨.૫૦

જો સદર આઈટમના ભાવ રૂ. ૧૨/- કે તેથી નીચે ભરેલ હોત તો રનીંગ બિલમાં ભાવ કપાત આ જોગવાઈ મુજબ કરવાની રહેતી નથી.

સર્તી/-

(આર.કે. ચૌહાણ)

ખાસ ફરજ પરના અધિકારી
માર્ગ અને મકાન વિભાગ

પ્રતિ,

તમામ અધિક્ષક ઈજનેરશ્રીઓ, માર્ગ અને મકાન વિભાગ,
તમામ કાર્યપાલક ઈજનેરશ્રીઓ, મા.મ. વિભાગ


નકલ રવાના :

૧. સચિવશ્રીના અંગત મદદનીશશ્રી, મા.મ. વિભાગ.
૨. તમામ મુખ્ય ઈજનેરશ્રી અને અ.સ.શ્રી મા.મ. વિભાગ.
૩. તમામ તાંત્રિક ઉપસચિવશ્રીઓ, મા.મ. વિભાગ
૪. ના.કા.ઈ.શ્રીઓ, મા.મ. વિભાગ પ્રે.પર
૫. નાણા શાખા, મા.મ. વિભાગ
૬. ના.સે.અ. સિલેક્ટ ફાઈલ
૭. શાખા સિલેક્ટ ફાઈલ.



બી.જે.દવે
નાયબ નાણાં નિયંત્રક

ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ
જલસેવા ભવન, સે.૧૦-એ ગાંધીનગર.
ફોન નં. ૨૩૨૫૧૦૪૮, ૮૮૭૮૪૪૧૧૦૨ (ફેક્સ: ૨૩૨૨૫૮૭૮)



તાત્કાલીક/સમય મર્યાદા

જા.નં. એબી/સીમે-૧-૨/આંતરીક ઓડિટ/૧૫-૧૬/ફા.નં. ૨૧/૪૭૧

તા. ૧૩/૭/૧૭

પ્રતિ,


- (૧) મુખ્ય ઇજનેરશ્રી,
ઝોન-૧/૨/૩/૪/૫,
વડોદરા/અમદાવાદ/રાજકોટ/ભુજ/જુનાગઢ
- (૨) નિયામકશ્રી, ગુજરાત જલસેવા તાલીમ સંસ્થા, ગાંધીનગર
- (૩) કાર્યપાલક ઇજનેરશ્રી, જા.આ.યાં.સ્ટોર વિભાગ, ગાંધીનગર.

વિષય :- સને ૨૦૧૬-૧૭ નાં આંતરીક ઓડીટની પુર્તતા કરવા બાબત.

ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે, આપના તાબા હેઠળની ક્ષેત્રિય કચેરીઓ દ્વારા પ્રથમ અને દ્વિતીય સમયગાળાનાં આંતરીક ઓડીટ અહેવાલ અંગેનો પુર્તતા રીપોર્ટ રજુ કરાયેલ નથી જે ખૂબજ ગંભીર બાબત છે. આથી તાત્કાલીક આ બાબત હાથ પર લઈ ઓડીટ અહેવાલની પુર્તતા તા. ૩૧-૭-૨૦૧૭ સુધીમાં સંબંધિત ઓડીટરશ્રી પાસેથી સ્વીકૃત કરાવી વડી કચેરી ખાતે રજુ કરવા જણાવવામાં આવે છે.

વધુમાં જણાવવાનું કે સને ૨૦૧૬-૧૭ ના બોર્ડના હિસાબોના ઓડીટ માટે સ્ટેચ્યુટરી ઓડીટરશ્રીની નિમણૂક સત્વરે થનાર છે. સ્ટેચ્યુટરી ઓડીટ ની કામગીરી માટે આંતરીક ઓડીટની તમામ કામગીરી યોગ્ય રીતે પૂર્ણ થયેલ હોવી અનિવાર્ય છે. આ બાબત લક્ષમાં લઈ, આપની કક્ષાએથી અંગત રસ લઈ બન્ને સમયગાળાના ઓડીટ અહેવાલની પૂર્તતા આપેલ સમયમર્યાદા માં અત્રે ઉપલબ્ધ કરાવવા ભારપૂર્વક વિનંતી છે.

સદરહુ બાબતને ટોચ અગ્રતા આપવા જણાવવામાં આવે છે, જેથી સ્ટેચ્યુટરી ઓડિટ હાથ ધરી અને બોર્ડના આખરી હિસાબો સમયસર વિધાનસભા ગૃહનાં મેજ ઉપર મુકી શકાય.


(બી.જે. દવે)

નાયબ નાણાં નિયંત્રક

જી.એસ.ટી.(GST) કાયદા અન્વયે જરૂરી
સૂચનાઓ.

ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ

“જલસેવા ભવન” સે.૧૦-એ, ગાંધીનગર.

પરિપત્ર નં. એબી/સીમે-૧-૨/જીએસટી/ફા.નં.૭૧/૧૭૦

તા. ૧૦/૦૭/૨૦૧૭

પરિપત્ર :

સરકારશ્રી દ્વારા તા ૦૧-૦૭-૨૦૧૭ થી જી.એસ.ટી.(GST) કાયદો અમલમાં મૂકવામાં આવેલ છે. આના પરિણામે અગાઉના વેટ તેમજ સર્વિસ ટેક્સ અંગેના કાયદાની જોગવાઈઓને બદલે ૦૧-૦૭-૨૦૧૭ થી જી.એસ.ટી.(GST) અંગેની જોગવાઈઓનું પાલન કરવાનું રહે છે. આ સંદર્ભમાં ગુજરાત પાણી પુરવઠા અને ગટરવ્યવસ્થા બોર્ડને અનુલક્ષીને નીચે મુજબની સૂચનાઓ બહાર પાડવામાં આવે છે.

- (૧) જી.એસ.ટી.(GST) એક્ટની કલમ-૫૧ હેઠળ ટીડીએસ કરવાની જોગવાઈ કેન્દ્ર સરકાર દ્વારા તા.૨૬.૦૬.૨૦૧૭ ની પ્રેસનોટથી હાલ સ્થગીત કરવામાં આવેલ છે. આથી કોન્ટ્રાક્ટર્સ/ અન્ય સપ્લાયર્સના બીલોમાંથી GST ની કપાત હાલ કરવાની થાય નહીં. આ પ્રેસનોટ Annexure-1 સ્વરૂપે સામેલ છે. પરંતુ આ અંગે સરકારશ્રી દ્વારા કોઈ જાહેરનામું બહાર ન પાડેલ હોય, હાલ સલામતીના પગલારૂપે ચૂકવણીમાંથી GST સંબધી કપાત કરી તેને ડિપોઝિટ તરીકે રાખવાની રહેશે. સરકારશ્રી કક્ષાએથી આ અંગે સૂચનાઓ જાહેર થયેથી તેને આનુષંગિક અત્રેથી જરૂરી સૂચનાઓ આપવામાં આવશે.
- (૨) હાલ જે ટેન્ડર ઓનલાઇન ચાલુમાં હોય તેમાં સમયમર્યાદા ઓછામાં ઓછા ૧૦ દિવસ લંબાવવી. હવે પછી બહાર પાડવામાં આવનાર ટેન્ડર સંદર્ભે GST ની ગણતરી કરીને તે સહીતના ભાવ ભરવાના રહેશે તેમ બીડરોને જણાવવું. આ અંગેની નિયત Tender Clause તૈયાર કરવાની કામગીરી વડિ કચેરી ખાતે ચાલુમાં છે, જે તૈયાર થયેથી પરિપત્રીત કરવામાં આવશે.
- (૩) એક્સાઈઝ એક્સેમ્પ્શન અંગે હાલના ટેન્ડરોમાં નવી સૂચનાઓ ન મળે ત્યાં સુધી કોઈ વેરિએશનનું ચૂકવણી કરવાનું રહેશે નહીં. આ માટે વડીકચેરી કક્ષાએ એક કમીટીની રચના કરવામાં આવી રહેલ છે, જેની મંજૂરી લઈ વેરિએશનની ચૂકવણી કરવાની રહેશે.

- (૪) જી.એસ.ટી.(GST) કાયદા મુજબ અનરજીસ્ટર્ડ વ્યક્તિ પાસેથી ખરીદેલ માલ/સેવાઓ પેટે ભરવાપાત્ર જી.એસ.ટીની રકમ સંબંધે રીવર્સચાર્જની જોગવાઈ લાગુ પડશે અને તે પેટે ચુકવવા પાત્ર જી.એસ.ટી, ખરીદનાર/સેવા લેનાર (Recipient)દ્વારા ચુકવવાનો રહેશે. આથી તા.૩૦/૦૬/૨૦૧૭ બાદ પૂરા પાડવામાં આવેલ માલ કે સેવાઓ સંદર્ભે સંબંધિત કોન્ટ્રાક્ટ્સ/પાર્ટી દ્વારા રજુ થતા બીલો ઉપર GST નંબર અચૂકપણે દર્શાવેલ હોવો જરૂરી છે.
- (૫) જી.એસ.ટી.(GST) હેઠળ ચુકવવા પાત્ર રકમની યોગ્ય હિસાબી નોંધ થાય તે હેતુથી નવો હિસાબી કોડ વિગતવાર સદર 1313(01)-GST From Agencies ફાળવવામાં આવેલ છે. જી.એસ.ટી. હેઠળ ભરવાપાત્ર થતી રકમની હિસાબી અસર માટે સંબંધિત કોડનો ઉપયોગ કરવાનો રહેશે.
- (૬) જી.એસ.ટી.(GST) સંદર્ભે આગામી સમયમાં વધુ માહિતી/સૂચનાઓ ઉપલબ્ધ થયેથી વિગતવાર સૂચનાઓ અત્રેથી સમયાંતરે બહાર પાડવામાં આવશે, જેનું ચુસ્ત પણે પાલન કરવાનું રહેશે.
- (૭) જી.એસ.ટી.(GST) સંદર્ભે તાત્કાલિક માર્ગદર્શન માટે બોર્ડ દ્વારા નિયુક્ત કરાવેલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પેઢી સુનિલ ઠક્કર એન્ડ કું.નો સંપર્ક કરવો.



(આર.એચ.દવે)

નાણાં નિયંત્રક

બિડાણ :- ઉપર મુજબ

પ્રતિ,

- ૧). મુખ્ય ઇજનેરશ્રીની કચેરીએ (સર્વે)
- ૨). અધિક્ષક ઇજનેરશ્રી(સર્વે)
- ૩). કાર્યપાલક ઇજનેરશ્રી(સર્વે),

નકલ સવિનય રવાના :-

- ૧) મા. સભ્ય સચિવશ્રીના અંગત મદદનીશશ્રી, ગુ.પા.પુ. અને ગ.વ્ય.બોર્ડ, ગાંધીનગર.

નકલ રવાના :-

- ૧) નાયબ નાણાં નિયંત્રકશ્રી, ગુ.પા.પુ. અને ગ.વ્ય.બોર્ડ, ગાંધીનગર.
- ૨). સીનીયર મેનેજરશ્રી(ના/હિ) તમામ
- ૩) સીસ્ટમ મેનેજરશ્રી, કોમ્પ્યુટર સેલ, વડી કચેરી, ગાંધીનગર.
- ૪). નાયબ મેનેજરશ્રી(ના/હિ) તમામ
- ૫). સુનિલ ઠક્કર એન્ડ કું., ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ

5/26/2017

Postponement of provision relating to TDS (Section 51) and TCS (Section 52) of the CGST / SGST Act 2017

 Print

XClose

**Press Information Bureau
Government of India
Ministry of Finance**

26-June-2017 16:21 IST

Postponement of provision relating to TDS (Section 51) and TCS (Section 52) of the CGST / SGST Act 2017

With the objective of ensuring smooth rollout of GST and taking into account the feedback received from the trade and industry regarding the provisions of deduction of tax at Source under Section 51 of the CGST / SGST Act 2017 and collection of tax at source under Section 52 of the CGST / SGST Act 2017, the following has been decided :-

1. The provisions of Tax Deduction at Source (Section 51 of the CGST / SGST Act 2017) and Tax Collection at Source (Section 52 of the CGST/SGST Act, 2017) will be brought into force from a date which will be communicated later.
2. Persons who will be liable to deduct or collect tax at source will be required to take registration, but the liability to deduct or collect tax will arise from the date the respective sections are brought in force.
3. The persons who were liable to be registered under clause (ix) of Section 24 of the CGST / SGST Act, 2017 (as they were supplying goods or services through electronic commerce operator who is required to collect tax at source under Section 52) will not be liable to register till the provision of Tax Collection at Source is brought under force. In other words, persons supplying goods or services through electronic commerce operator liable to collect tax at source would not be required to obtain registration immediately, unless they are so liable under Section 22 or any other category specified under Section 24 of the CGST / SGST Act, 2017 .

This step has been taken to provide more time for persons liable to deduct tax at source / E-Commerce Companies and their suppliers to prepare for the historic tax reform.

SBS/VL/PM

ટેન્ડરમાં ભરેલ અસામાન્ય ઊંચા ભાવોના સંદર્ભે કામ પર પડતા ખર્ચ પર નિયંત્રણ રાખવા તથા કામની નાણાકીય પ્રગતિ સાથે સુમેળમાં રહે તે માટે જરૂરી જોગવાઈ કરવા બાબત.

ગુજરાત સરકાર
માર્ગ અને મકાન વિભાગ

પરિપત્ર ક્રમાંક:- પરચ-૧૦૨૦૦૮-(૬૧)-સી

તા. ૦૩-૦૫-૨૦૧૩

વંચાણે લીધા:- પરિપત્ર ક્રમાંક:- પરચ-૧૦૨૦૦૮-(૬૧)-સી તા. ૨૭-૧૧-૨૦૦૮

આમુખ:-


ટેન્ડર માં ઈજારદારશ્રીઓ દ્વારા ભરાતા Imbalanced ભાવો વાળા ટેન્ડરના કિસ્સાઓમાં ઈજારદારશ્રીઓ દ્વારા ઊંચા ભાવની આઈટમોની કામગીરી કર્યા બાદ નીચા ભાવની આઈટમોની કામગીરી ન કરવામાં આવે તેવી પરિસ્થિતિ પર નિયંત્રણ રાખવા માટે તા. ૨૭-૧૧-૨૦૦૮ નો પરિપત્ર જરૂરી જોગવાઈ સાથે બહાર પાડવામાં આવેલ. આ પરિપત્ર અંગે વિવિધ સ્તરોએ થયેલ રજુઆતોને ધ્યાને લેતાં અને તેના પર પુખ્ત વિચારણાના અંતે આ પરિપત્રના બીજા ફકરાની છેલ્લી લીટી "આ રીતે વીથહેલ રાખેલ રકમ કામ સંતોષકારક રીતે પૂર્ણ થયે ફાઈનલ બીલ મંજૂર કરતી વખતે વ્યાજભારણ વગર છૂટી કરવામાં આવશે" તેની જગ્યાએ નીચે મુજબનો સુધારો કરવામાં આવે છે.

સુધારો:-

"આ રીતે વીથહેલ રાખેલ રકમ અસાધારણ નીચા ભાવ ભરેલ હોય તેવી આઈટમની નાણાકીય પ્રગતિનાં પ્રમાણસર રનીંગ બીલમાંથી છૂટી કરવાની રહેશે. જે કિસ્સામાં અસાધારણ નીચા ભાવ ભરેલ કોઈપણ આઈટમ ન હોય તેવા કિસ્સામાં અસાધારણ ભાવો ભરેલ આઈટમની સામે વીથહેલ રાખેલ રકમ બાકી રહેતી કામગીરી થાય તેના પ્રમાણસર રનીંગ બીલમાંથી છૂટી કરવાની રહેશે."

વધુમાં વંચાણે લીધેલ પરિપત્ર ના ઉદાહરણમાં દર્શાવેલ ક્રમાંક-૮ રદ કરવામાં આવે છે.

ઉપરોક્ત સુધારાનો અમલ આ પરિપત્રની તારીખ પછી મંજૂર થતા ડી.ટી.પી. માં અચૂકપણે કરવાનો રહેશે.



(આર.કે. ચૌહાણ)

ખાસ ફરજ પરના અધિકારી(વિ.યો.)

માર્ગ અને મકાન વિભાગ

પ્રતિ,
સર્વે અધિકારી ઈજનેરશ્રીઓ, મા.મ. વિભાગ (પાટનગર યોજના વર્તુળ, નેશનલ હાઈવે વર્તુળ સહિત).
સર્વે અધિકારી ઈજનેરશ્રીઓ (પંચાયત) મા.મ. વિભાગ.
સર્વે કાર્યપાત્રક ઈજનેરશ્રીઓ, મા.મ. વિભાગ.
સર્વે કાર્યપાત્રક ઈજનેરશ્રીઓ, (પંચાયત), મા.મ. વિભાગ.

નકલ રવાના:-


૧. અગ્ર સચિવશ્રીના અંગત મદદનીશશ્રી, મા.મ. વિભાગ, સચિવાલય, ગાંધીનગર
૨. સર્વે મુખ્ય ઈજનેર અને અ.શ્રીઓ, મા.મ. વિભાગ.
૩. સર્વે તાંત્રિક ઉપ સચિવશ્રીઓ, મા.મ. વિભાગ.
૪. ના.કા.ઈ શ્રીઓ, મા.મ. વિભાગ.
૫. નાણાં શાખા, મા.મ. વિભાગ.
૬. ના.સે.અ., સી શાખા, મા.મ. વિભાગ., સિલેક્ટ ફાઈલ
૭. શાખા સિલેક્ટ ફાઈલ - ૨૦૧૩



આર.એચ.દવે
નાણાં નિયંત્રક

ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ

(ગુજરાત સરકારનું સાહસ)
"જલસેવા ભવન" સેક્ટર નં.૧૦/એ, એરડ્રોસ કચેરીની સામે, ગાંધીનગર-૩૮૨ ૦૧૦



જલ સેવા મંડળ નં. ૩૪

Ph. No. 079-23251048 PABX : 23222547

FAX No. 079-232 25979

Email :- fcgwssb@gmail.com, website : gwssb.gujarat.gov.in

ન. એબી/સીમે-૧-૨/૨૦૧૭-૧૮/ફા.નં.૬૫/૨૬૩

તા. ૨૭ / ૧૦ / ૧૭

પ્રતિ,

- (૧) મુખ્ય ઇજનેરશ્રી,
ઝોન-૧ વડોદરા/ઝોન-૨ અમદાવાદ
ઝોન-૩ રાજકોટ/ઝોન-૪ કચ્છ-ભુજ/ઝોન-૫ જુનાગઢ
- (૨) પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી, અર્બનસેલ, વડી કચેરી, ગાંધીનગર.
- (૩) નિયામકશ્રી, જીજેટીઆઇ, સે.૧૫, ગાંધીનગર.
- (૪) કાર્યપાલક ઇજનેરશ્રી, જા.આ.યાં.સ્ટોર વિભાગ, ગાંધીનગર.

વિષય :- સરકારશ્રીના માર્ગ અને મકાન વિભાગના ઠરાવ અન્વયે ટેન્ડરમાં જથ્થા વધારા તથા જથ્થા વધારાના ભાવનાં માપદંડમાં સુધારણા કરવા બાબત.

- સંદર્ભ :- ૧) માર્ગ અને મકાન વિભાગ ગાંધીનગરના પરીપત્ર નં. ટીએનસી-૧૦-૨૦૧૭-૦૧-સી, તા.૧૧.૭.૨૦૧૭
૨) બોર્ડ નિયામક મંડળની બેઠક નં. ૨૬૪ એજન્ડા નં. ૧૪

ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે, ટેન્ડરમાં જથ્થા વધારા તથા જથ્થા વધારાના ભાવનાં માપદંડ બાબતે બી-૧ અને બી-૧ ટેન્ડરનાં કલોઝ ૧૪.૨ માં જણાવ્યા મુજબ જથ્થા વધારા માટે ૩૦ ટકા સુધીનો જથ્થો ટેન્ડરનાં ભાવથી અને ૩૦ ટકાથી વધુ જથ્થામાં વધારો હોય તો જે તે વર્ષમાં કામગીરી કરેલ હોય તે વર્ષનાં એસ.ઓ.આર.થી કરવાની જોગવાઈ હતી. સદરહુ જોગવાઈમાં આ સાથે સામેલ સંદર્ભ (૧) પ્રમાણેના પરીપત્ર મુજબ ટેન્ડર કલોઝ ૧૪.૨ માં સુધારો કરવામાં આવેલ છે. આ મુજબ પાણી પુરવઠા બોર્ડનાં ટેન્ડરોમાં પણ આ પરીપત્ર મુજબ કાર્યવાહી કરવા જણાવવામાં આવે છે.

સદર બાબતને બોર્ડ નિયામક મંડળની ૨૬૪ મી બેઠકમાં એજન્ડા નં.૧૪ થી મંજૂરી આપવામાં આવે છે.

બિડાણ : ઉપર મુજબ

(આર.એચ.દવે)
નાણાં નિયંત્રક

નકલ સવિનય રવાના

- માન અધ્યક્ષશ્રીના કાર્યકારી સચિવશ્રી, વડી કચેરી, ગાંધીનગર.
- મહત્વ સચિવશ્રીના અગત મદદનીશશ્રી, વડી કચેરી, ગાંધીનગર.

નકલ રવાના

- મુખ્ય ઇજનેરશ્રી ટેકનીકલ/(મોની/પ્લાં)/મટીરીયલ/યાંત્રિક/ વડી કચેરી, ગાંધીનગર.
- મુખ્ય વહીવટી અધિકારીશ્રી, વડી કચેરી, ગાંધીનગર.
- અધિક્ષક ઇજનેરશ્રી, ટેકનીકલ/મોની-પ્લાં/મટીરીયલ/વડી કચેરી, ગાંધીનગર.
- અધિક્ષક ઇજનેરશ્રી, તકેદારી એકમ, વડી કચેરી, ગાંધીનગર.
- સીનિયર મેનેજરશ્રી (ના/હિ) ૧-૨/૩-૪-૫ વડી કચેરી, ગાંધીનગર.

ટેન્ડરમાં જથ્થાવધારા તથા
જથ્થાવધારાના ભાવના માપદંડમાં
સુધારણા કરવા બાબત

ગુજરાત સરકાર
માર્ગ અને મકાન વિભાગ
પ્લોટ નં. ૧૪/૨, સરદાર ભવન,
સચિવાલય, ગાંધીનગર
ઠરાવ ક્રમાંક: TNC-10-2017-01-C
તા. ૧૧/૦૭/૨૦૧૭

ઠરાવ

ટેન્ડરમાં જથ્થાવધારા તથા જથ્થાવધારાના ભાવના માપદંડ બાબતે બી-૧ અને બી-૨ ટેન્ડરના કલોઝ ૧૪.૨ માં જણાવ્યા મુજબ જથ્થાવધારા માટે ૩૦ ટકા સુધીનો જથ્થો ટેન્ડરના ભાવથી અને ૩૦ ટકાથી વધુ જથ્થાના વધારો હોય તો જે તે વર્ષમાં કામગીરી કરેલ હોય તે વર્ષના એસ.ઓ.આર.થી કરવાની જોગવાઈ છે.

સદરહુ જોગવાઈમાં સુધારણા કરવા બાબતે સરકારશ્રીમાં ઘણા લાંબા સમયથી વિચારણા હેઠળ હતું. જે અન્વયે નીચે મુજબનો સુધારો કરવામાં આવે છે.

EXISTING CLAUSE	AMENDMENT
Form B-1 Clause- 14.2	Form B-1 Clause- 14.2
Form B-2 Clause- 14.2	Form B-2 Clause- 14.2
Except that when the quantity of any item exceeds the quantity as in the tender by more than 30% the contractor will be paid for the quantity in excess of 30% at the rate entered in the SOR of the year during which the excess in quantity is first executed and for the material consumed in excess quantity the rate for the material to be charged would be basic rate taken into account for fixing the rate for the SOR above instead of the rate stipulated in Schedule-A.	Except that when the quantity of any item exceeds the quantity as in the tender by more than 10% the contractor will be paid for the quantity in excess of 10% at the rate entered in the SOR of the year during which the excess in quantity is first executed or tender rate whichever is less.

ઉપરોક્ત તમામ સુચનાનો અમલ યુક્તપણે તાત્કાલિક અસરથી કરવાનો રહેશે.

ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,

(ચેન. જ. પરમાર)
ખાસ ફરજ પરના અધિકારી (વિ. યો.)
માર્ગ અને મકાન વિભાગ
ગાંધીનગર



તુષાર એમ. ઘોઝકિયા, આઈ.એ.એસ.
સભ્ય સચિવ

ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ

(ગુજરાત સરકારનું સાહસ)

“જલસેવા ભવન”, છ-રોડ, એરફોર્સ સ્ટેશન સામે, સેક્ટર-૧૦-એ, ગાંધીનગર.

ફેક્ષ : (૦૭૯) ૨૩૨૫૧૦૮૬

ફોન નં. : ૯૧-૦૭૯-૨૩૨૫૧૦૪૯, ૨૩૨૨૨૪૧૭

E-mail : msgwssb@gmail.com

Website : www.gwssb.gujarat.gov.in

એબી/સી.મે.૩-૪/ફંડ ફાળવણી/ઝોન-૧/૨૦૧૮-૧૯/૫૧૮

તા.૧૦/૦૧/૨૦૧૮

પ્રતિ

મુખ્ય ઇજનેરશ્રી

ઝોન-૧/૨/૩/૪/૫, વડોદરા/અમદાવાદ/રાજકોટ/ભૂજ/જુનાગઢ

નિયામકશ્રી,

ગુજરાત જલસેવા તાલીમ સંસ્થા, ગાંધીનગર

કાર્યપાલક ઇજનેરશ્રી(યાં), જા.આ.યાં.સ્ટોર વિભાગ, ગાંધીનગર

વિષય : ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ ધ્વારા બહાર પાડવામાં આવતા યોજનાકીય કામોના ટેન્ડરના CLASUE-II માં સુધારો કરવા બાબત.

પ્રસ્તાવના

ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની વિવિધ કચેરીઓ ધ્વારા બહાર પાડવામાં આવતા યોજનાકીય કામોના ટેન્ડરોમાં, કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ ન થવાના કિસ્સાઓ સંદર્ભે CLASUE-II Liquidated Damages ની જોગવાઈ રાખવામાં આવે છે. આ બાબતે ધ્યાન પર આવ્યા મુજબ નીચેની વિગતે સુધારો કરવામાં આવે છે.

પરિપત્ર :

(૧) ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની તમામ ક્ષેત્રિય કચેરીઓ ધ્વારા યોજનાકીય કામગીરી માટે બહાર પાડવામાં આવતા ટેન્ડરોના CLASUE-II Liquidated Damages ની જોગવાઈમાં નીચે મુજબનો સુધારો બોર્ડ હિતમાં કરવામાં આવે છે.

Clause-II : Liquidated Damages:


The aggregate maximum of liquidated damages payable under clause No.2 shall not exceed 0.1 percentage of contract value per day and shall be subject to the maximum amount of ten percentage of the estimated amount put to tender or contract value whichever is higher.

(૨) આ જોગવાઈ મુજબ Liquidated Damages ની ગણતરી કરતી વખતે નીચેની બાબતે ધ્યાનમાં લેવાની રહેશે.

(૨.૧) વિલંબના પ્રત્યેક દિવસ માટે કામની કરાર કિંમત (Contract Value) ના ૦.૧% લેખે વિલંબ વળતર વસુલાતપાત્ર થશે.

(૨.૨) ઉપરોક્ત મુદ્દાનં.(૧) માં જણાવ્યા મુજબ વિલંબ વળતરની મહત્તમ રકમ ટેન્ડરમાં મૂકેલ અંદાજિત રકમ - Estimated amount put to tender અથવા કામની કરાર કિંમત (contract value) પૈકી જે વધુ હોય તેના મહત્તમ ૧૦% સુધીની રહેશે.

આ પરિપત્રની સૂચનાઓ હવે પછી બહાર પાડનાર તમામ પ્રકારના ટેન્ડરમાં તાત્કાલિક અસરથી અમલમાં લાવી તે અંગેની અત્રે જાણ કરવી.


(તુષાર એમ. ધોળકિયા)
સભ્ય સચિવ

નકલ સવિનય વિદિત થવા વિનંતી સહ રવાના:

- ૧) માન. અધ્યક્ષશ્રી, ગુ.પા.પુ.અને ગ.વ્ય.બોર્ડ, ગાંધીનગર
- ૨) વહીવટી સંચાલકશ્રી, ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લી., ગાંધીનગર
- ૩) મુખ્ય કારોબારી અધિકારીશ્રી, વાસ્મો, ગાંધીનગર

નકલ રવાના જાણ તથા સમય મર્યાદામાં અમલ અંગેની જરૂરી કાર્યવાહી અર્થે :

- ૧) નાણાં નિયંત્રકશ્રી, બોર્ડ કચેરી, ગાંધીનગર
- ૨) મુખ્ય વહીવટી અધિકારીશ્રી, બોર્ડ કચેરી, ગાંધીનગર
- ૩) મુખ્ય ઇજનેરશ્રી, (મો./પ્લા), બોર્ડ કચેરી, ગાંધીનગર
- ૪) મુખ્ય ઇજનેરશ્રી, (ટેકનીકલ), બોર્ડ કચેરી, ગાંધીનગર
- ૫) પ્રોજેક્ટ ડાયરેક્ટર, અર્બન સેલ, બોર્ડ કચેરી, ગાંધીનગર
- ૬) મુખ્ય ઇજનેરશ્રી, યાંત્રિક સેલ, બોર્ડ કચેરી, ગાંધીનગર
- ૭) મુખ્ય ઇજનેરશ્રી, મટીરીયલ સેલ, બોર્ડ કચેરી, ગાંધીનગર
- ૮) નાયબ નાણાં નિયંત્રકશ્રી, બોર્ડ કચેરી, ગાંધીનગર
- ૯) અધિક્ષક ઇજનેરશ્રી (તમામ)
- ૧૦) કાર્યપાલક ઇજનેરશ્રી (તમામ)
- ૧૧) સીસ્ટમ મેનેજરશ્રી, કોમ્પ્યુટર સેલ, બોર્ડ કચેરી ગાંધીનગર તરફ બોર્ડની વેબસાઇટ પર મૂકવા સારું.
- ૧૨) સીનીયર મેનેજરશ્રી (ના/હિ)/નાયબ મેનેજર (ના/હિ) સર્વે,
- ૧૩) વિભાગીય હિસાબનીશ્રી, હિસાબી શાખા, બોર્ડ કચેરી, ગાંધીનગર